

જીસીવીટી એફીલીએશન માટેની માર્ગદર્શિકા

૧. જી.સી.વી.ટી. એફીલીએશન મેળવવા માટે પ્રોસેસિંગ અને ફોર્મ ફીના કુલ Rs.-૫૨૦૦/- www.gcvt.org વેબસાઈટ પર ઓનલાઈન ભરવાની રહેશે.
૨. જીસીવીટી એફીલીએશન મેળવવા માટે સ્ટેજ -૧ અને ૨ નાં ફોર્મ <http://talimroigar.gujarat.gov.in> ઉપરથી ડાઉનલોડ કરવા.
૩. સ્ટેજ-૧ ના ફોર્મમાં દર્શાવેલ જરૂરી તમામ માહિતી અચૂક ભરવી. સ્ટેજ-૧ નું ફોર્મ, પ્રોસેસિંગ ફીની રીસિપ્ટ, નોટરાઇઝ્ડ એફિડેવિટ અને ફોર્મમાં દર્શાવ્યા મુજબના જરૂરી તમામ આધાર પુરાવા સાથે અરજી અત્રેની કચેરીને મોકલી આપવાની રહેશે. (નોંધ: સંસ્થા ધ્વારા જમા કરાવેલ દસ્તાવેજો કોઈ પણ સંજોગોમાં સંસ્થાને પરત કરવામાં આવશે નહીં.)
૪. ઓગસ્ટ -૨૦૨૦ ના પ્રવેશ સત્ર માટે જીસીવીટી એફીલીએશનની સ્ટેજ-૧ ની અરજી જરૂરી બિડાણ સહ અત્રેની કચેરીને તા. ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ સાંજે ૪-૦૦ કલાક સુધી પહોંચાડવાની રહેશે. મુદત વિત્યા બાદ કોઈ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં / સ્વીકારવામાં આવશે નહીં. અધુરી વિગતવાળા અરજી પત્રક ધ્યાને લેવામાં આવશે નહીં અને તે રદ થયેલ ગણાશે.
૫. સ્ટેજ-૧ ની અરજી અન્વયે અત્રેની કચેરી ધ્વારા ચકાસણી કર્યા બાદ કોઈ પણ પ્રકારની ક્ષતિ ધ્યાને આવશે તો અરજદારને અત્રેની કચેરી ધ્વારા આપવામાં આવતી સમય મર્યાદામાં ક્ષતિ પૂર્ણ કરવા ઈ મેલથી જાણ કરવામાં આવશે.
- ૬ . સ્ટેજ-૧ ની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ સ્ટેજ-૨ની અનુગામી કાર્યવાહી કરવા અત્રેની કચેરી ધ્વારા અરજદાર ને **LOI (Letter of Intent)** થી જાણ કરવામાં આવશે.
૭. સ્ટેજ-૨ ની કાર્યવાહી માટે અત્રેની કચેરીની સૂચનાનુસાર **LOI (Letter of Intent)** બાદ સમયમર્યાદામાં સ્ટેજ-૨ નું ફોર્મ જરૂરી તમામ આધાર પુરાવા સાથે અરજદારે અત્રેની કચેરીને નિયત સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
૮. સ્ટેજ-૨ નું ફોર્મ અત્રેની કચેરીને મળ્યા બાદ તેની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ કમિટી ધ્વારા સ્ટેજ-૧ અને સ્ટેજ-૨ માં આપેલ વિગતોને અનુલક્ષીને રુબરુ સ્થળ પર ચકાસણી કરાવવામાં આવશે. કમિટીના નિરીક્ષણ દરમ્યાન ક્ષતિ ધ્યાને આવશે તો તેની પણ પુર્તતા નિરીક્ષણ ટીમ ધ્વારા આપવામાં આવેલ સમય મર્યાદામાં કરવાની રહેશે.
૯. સ્થળ નિરીક્ષણની કમિટી ધ્વારા એફીલીએશનના નિરીક્ષણનો અહેવાલ અત્રેની કચેરીને મળ્યા બાદ જીસીવીટી એફીલીએશનની નિયમોનુસારની અનુગામી પ્રક્રિયા હાથ ધરી શકાશે.
૧૦. ઉક્ત તમામ કાર્યવાહી નિયમોનુસાર પૂર્ણ થયેથી અરજદારે અત્રેની કચેરીની સુચનાનુસાર નિયમોનુસાર (પ્રતિ વ્યવસાય પ્રતિ બેચ દીઠ રૂ. ૨૫૦૦૦/-) નોન રીફન્ડેબલ જીસીવીટી એફીલીએશન ફી નો ડિમાન્ડ ડ્રાફ્ટ નિયત સમય મર્યાદામાં જીસીવીટીમાં જમા કરાવવાનો રહેશે.

૧૧. જીસીવીટી એફીલીએશન ફી નો ડી.ડી. રજુ કર્યા બાદ જ જીસીવીટી એફીલીએશનના આદેશ પ્રદાન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
૧૨. જીસીવીટી એફીલીએશનની તમામ કામગીરી તા. ૩૦/૦૬/૨૦૨૦ સુધીમાં પૂર્ણ થશે તેમને જ ઓગસ્ટ-૨૦૨૦ ના સત્ર માટે એફીલીએશન પ્રદાન કરવામાં આવશે.
૧૩. ઓગસ્ટ-૨૦૨૦ ના સત્રથી સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઈડ સંસ્થાઓની માફક સ્વનિર્ભર સંસ્થાઓમાં પણ તાલીમાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા અત્રેની કચેરીના પોર્ટલ <https://itiadmission.gujarat.gov.in> પર ઓનલાઇન કરવાની રહેશે.
૧૪. જીસીવીટી એફીલીએશનના આદેશ મેળવ્યા વગર તાલીમાર્થીઓના પ્રવેશની કાર્યવાહી કરી શકાશે નહીં.

(NO Affiliation No Admission)